



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૧૨/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૦૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૨ કેસ કરી, ૫૮ વ્યક્તિઓને ઝડપી, ૧૮૦ લીટર દેશી દારૂ, ૭૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ રિક્ષા અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૩,૦૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૦૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૫૦૯/૧૮

નિકોલ: વિશાલભાઈ હેમતભાઈ પટેલ (રહે.ભુયંગદેવ સોસાયટી સોલા રોડ ઘાટલોડીયા) એ તા.૨૬/૧૨/૧૮ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૧/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન નિકોલ કઠવાડા જી.આઇ.ડી.સી ત્રિભોવન એસ્ટેટ રોડ નં-૮ પ્લોટ-૫૮ “કોપેક લેમીનેટર્સ એલ.એલ.પી” ખાતે આરોપી સૌમીલ મિત્રા (રહે.સુન્દરમ પ્લસ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા સામે અથુધર સ્ટ્રીટ નાનપુરા સુરત) એ “હું તમોને તમારા માલનું પેમેન્ટ આપી દઇશ તથા અન્ય વેપારીઓ પાસેથી પણ તમને મોટા ઓર્ડર અપાવીશ” તેમ કહી વિશ્વાસમાં લઇ,વિશાલભાઈના ઇમેલ આઇડી પર ઇ-મેઇલ કરી પ્લાસ્ટીકના રેપર પેકેજીંગનો માલ-સામાન કિંમત રૂપિયા ૨૯,૨૨,૨૭૬/- મેળવી લઇ આજદીન સુધી નાણા નહી ચુકવી વિશાલભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.વી.છાસટીયા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૫૧૦/૧૮

ઘાટલોડીયા: દિપેનભાઈ હસમુખભાઈ રાહોડ (રહે.એનીગ્મા ફ્લેટ, કેમ્પે હોટેલની બાજુમા ગુલાબટાવર પાસે થલતેજ) એ તા.૨૬/૧૨/૧૮ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૧૨/૧૮ સાજના ૬/૩૦ થી તા.૨૬/૧૨/૧૮ કલાક ૮/૩૦ વાગ્યા દરમ્યાન ગુરુકુળ રોડ સુભાષચોકની બાજુમાં આવેલ હાર્વી કોપ્લેક્ષમા ચોથા માળે આવેલ દુકાન નંબર-૪૦૪ અને દુકાન નં-૪૦૫ ના દરવાજાના નકુચા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૧,૬૬,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એન.પરમાર ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૫૧૧/૧૮

નિકોલ: જીગરભાઈ મંગળભાઈ પટેલ (ઉ.વ.૩૯) (રહે. રોયલ બંડ્લોઝ મનોહરવીલા ચાર રસ્ત પાસે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૨૬/૧૨/૧૮ સવારના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રામસિંહ મોતીસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.